

રજુ થયા તારીખ:- ૨૯/૦૧/૨૦૨૫
દાખલ થયા તારીખ:-૨૯/૦૧/૨૦૨૫
નિકાલ થયા તારીખ:-૧૦/૦૯/૨૦૨૫
કુલ સમય ગાળો: વર્ષ માસ દિવસ
૦૦ ૦૭ ૧૨

મહે. શ્રી પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબની અદાલત સમક્ષ,
મુકામ : ભચાઉ-કચ્છ

રેગ્યુલર દિવાની દાવા નં.૬/૨૦૨૫
આંક-૨૮/એ

વાદી :-

બેંક ઓફ બરોડા-ભચાઉ બ્રાન્ચ
મારફતે-બ્રાન્ચ મેનેજર
યોગરાજ બબુલે લાલ, ઉ.વ.૩૯,
સરનામું-ભચાઉ બ્રાન્ચ, તા.ભચાઉ-કચ્છ.

///વિરૂદ્ધ///

પ્રતિવાદીઓ:-

(૧) વિજયભા રામભા ગઢવી(બોરોઅર)

ઉ.વ.પુખ્ત, ધંધો-ખેતી
રહે. ૧૨, નવી ભચાઉ, રામેશ્વર મંદીરની બાજુમાં,
ભચાઉ, તા.ભચાઉ, જી.કચ્છ.

(૨) જીલાબેન રામભા ગઢવી(ગેરેન્ટર)

ઉ.વ.પુખ્ત, ધંધો-ખેતી
રહે. ૧૨, નવી ભચાઉ, રામેશ્વર મંદીરની બાજુમાં,
ભચાઉ, તા.ભચાઉ, જી.કચ્છ.

(૩) રવાભા રામભા ગઢવી(ગેરેન્ટર)

ઉ.વ.પુખ્ત, ધંધો-ખેતી
રહે. ૧૨, નવી ભચાઉ, રામેશ્વર મંદીરની બાજુમાં,
ભચાઉ, તા.ભચાઉ, જી.કચ્છ.

વાદી તરફે વિધવાન વકીલ:-વી.પી.શ્રીમાળી

પ્રતિવાદીઓ તરફે વિધવાન વકીલ:- કોઈ નહી

દાવો:-રૂપિયા Rs.7,90,148/-વસુલ મેળવવા અંગે.
///જજમેન્ટ///

(૧) આ કામના વાદીની દાવા અરજીની ટુંકમા હકીકત એવી છે કે, વાદી બેંકીંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ હેઠળ એક બેંકીંગ સંસ્થા છે. વાદી બેંકીંગ ક્ષેત્રને લગતી સેવાઓ આપવાનું કામ કરે છે અને જેની રીજીયોનલ ઓફીસ બરોડા મધ્યે આવેલ છે જ્યારે તેની એક શાખા ભચાઉ મધ્યે આવેલ છે. આમ વાદી તે બેંક એ કોર્પોરેટ બોડી છે તથા આ કામના પ્રતિવાદી નં.૧ મુળભુત ઉધાર લેનાર અને નં.૨ અને ૩ વાળા તેમના ગેરેન્ટર છે. તેઓ વાદી બેંક ઓફ બરોડા ભચાઉ બ્રાન્ચ મધ્યે નોકરી કરે છે અને સદર દાવો તેઓએ વાદી બેંકના ઓથોરાઈઝડ પર્સન તરીકે કરેલ છે. વાદી બેંક હેડ ઓફીસ અને રીઝર્વ બેંકની સુચના અન્વયે નાણાકીય ધિરાણ, લોન તેમજ ઓવરડ્રાફ્ટની વિગેરે જેવી ફેસેલીટી જરૂરીયાત મંદ લોકોને તેમણે કરેલી રજુઆત અને રજુ કરેલા દસ્તાવેજી આધારોને આધારે આપે છે. એ રીતે આ કામના પ્રતિવાદીને તા.૭/૭/૨૦૨૩ ના રોજ બરોડા કાર લોન યોજના અંતર્ગત રૂ.૮,૨૯,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ ઓગણત્રીસ હજાર પુરા) ની રકમ બેંકના નિયમ મુજબ પ્રતિવાદીને વ્યાજની ચુકવણી તથા મુળ મુદ્દલ પરત મેળવવાની શરતો જોગવાઈઓ સાથે ધિરાણ આપેલ જેના બેંક એકાઉન્ટ નં.58580600002128 છે. પ્રતિવાદીઓએ વાદી બેંકને નિયમોનુસાર તમામ જરૂરી દસ્તાવેજો પર એમની સહી/અંગુઠો કરી આપેલ છે જે આ કામે દાવાઅરજી સાથે આધારલીસ્ટથી બેંકના રેકર્ડ મુજબના અસલ દસ્તાવેજો ઉપરથી દસ્તાવેજી આધારોની નકલ રજુ રાખેલ છે જેથી આ લોન ભરપાઈ કરી/કરાવી આપવાની જવાબદારી સ્વયં પ્રતિવાદીની રહે છે. આ કામના પ્રતિવાદીએ લોનીન રકમ નિયમીત માસિક હપ્તાથી ચુકવી આપવા ભરોસો અને વિશ્વાસ પણ આપેલ તેમ છતાં સદરહુ સમગ્ર લોન તથા તે પરના નિયમાનુસાર વ્યાજની રકમની ચુકવણી કરવામા નિષ્ફળ ગયેલ છે. આમ, આ કામના પ્રતિવાદી ઉપર તા.૬/૧૦/૨૦૨૪ ના રોજે રૂ. ૭,૯૦,૧૪૭.૫૭/- (અંકે રૂપિયા સાત લાખ નેવું હજાર એકસો સુડતાલીસ અને સતાવન પૈસા પુરા) ની રકમ બાકી નીકળે છે જે રકમ આ કામના પ્રતિવાદી ચુકવતા નથી તથા આ અંગે બેંકને કોઈપણ જાતનો સહકાર આપતા નથી આ રીતે પ્રતિવાદી રકમ ચુકવવામા ધિરાણપુર્વક બેદરકારી કરી ગુનાહિત માનસ દર્શાવેલ છે. પ્રતિવાદીએ મેળવેલ

ધિરાણ સામે વાદી બેંકને નિયમોનુસાર તમામ જરૂરી દસ્તાવેજો પર એમની સહી/અંગુઠો કરી આપેલ છે જે આ કામે દાવાઅરજી સાથે આધારલીસ્ટથી બેંકના રેકર્ડ મુજબના અસલ દસ્તાવેજો ઉપરથી દસ્તાવેજી આધારોની નકલ રજુ રાખેલ છે. આ દાવાનું કારણ આ કામના પ્રતિવાદીએ જે હેતુ માટે વાદી બેંક પાસેથી લોનનું ધિરાણ મેળવ્યા બાદ લોનની હપ્તાની રકમ ભરપાઈ કરવામા કસુર કરેલ હોઈ અને બેંકની કાયદેસરની રકમ વ્યાજ સહિત ચડત થઈ ગયેલ હોઈ અને વાદી બેંકના એડવોકેટ મારફતે તા. ૧૧/૧૦/૨૦૨૪ ના રોજ નોટીસ કરવા છતાં કોઈ દાદ આપેલ નહી. આ દાવો પ્રતિવાદીની કસુરે, તેમના ગુનાહિત માનસ તથા જવાબદારી વિહીન વર્તનના લીધે દાખલ કરવાનું કારણ ઉત્પન્ન થયેલ છે. આ દાવાનો આંક રૂ.૧૯,૮૫૦/- રજુ કરેલ છે. આ દાવાનું કારણ ચાલુ હોઈ આ દાવો લીમીટેશન એક્ટ તળે મુદ્દતમાં છે તેમજ આ દાવાનું કારણ ભચાઉ મધ્યે ઉત્પન્ન થયેલ હોઈ તથા વાદી ભચાઉ જી.કચ્છ મધ્યે શાખા ધરાવતા હોઈ તેમજ મુળ પ્રતિવાદી ભચાઉ તાલુકાના રહેવાસી હોય આ દાવો ચલાવવાની એકમાત્ર નામ.કોર્ટને હકુમત પહોંચે છે તેમ જણાવી દાદ માંગેલ છે કે, આ કામના પ્રતિવાદીઓને નામ.કોર્ટ રુબરુ બોલાવી આ કામના વાદી બેંકની કાયદેસરની લેણી રકમ તા.૬/૧૦/૨૦૨૪ ના રોજે રૂ. ૭,૮૦,૧૪૭.૫૭/-(અંકે રૂપિયા સાત લાખ નેવું હજાર એકસો સુડતાલીસ અને સતાવન પૈસા પુરા) આ દાવાના અંતિમ નિકાસ સમયે તે રકમ પર થતી ૧૨% વ્યાજ સહિત અને બેંકના કરાર મુજબ લોનની રકમ એક આંકડે ચુકવી આપે તેવો પ્રતિવાદીઓ વિરુદ્ધ હુકમ તથા હુકમનામું થવા અરજ છે તથા આ દાવાનુ તમામ ખર્ચ પ્રતિવાદીઓ પાસેથી વસુલ અપાવવા અરજ ગુજારેલ છે અને દાવાની હકુમત અને પુરાવાની નજરે મળી શકતી તમામ પ્રકારની કાયદેસરની દાદ અપાવવા અરજ ગુજારેલ છે.

(૦૨) વાદી બેંક ધ્વારા હાલનો દાવો અદાલત સમક્ષ દાખલ થતા આ કામના પ્રતિવાદીઓને દાવાનો સમન્સ કાઢવામા આવેલ જે સમન્સ આ કામે આંક-૬ થી

ઘોરણસરની બજવાણી કરેલ છે. આમ, પ્રતિવાદીઓને ઘોરણસરની સમન્સની બજવાણી થયેલ હોવા છતાં પ્રતિવાદીઓ તરફે તેઓ જાતે કે તેમના વકિલશ્રી દાવાના કામે ઉપસ્થિત રહેલ નથી કે દાવાની કાર્યવાહી દરમિયાન કોઈ જવાબ કે પુરાવો રજુ રાખેલ નથી. ત્યારબાદ આ કામે વાદીના વિ.વકિલશ્રીએ સી.પી.સી.ઓર્ડર-૯ રૂલ-૬ મુજબ પ્રતિવાદીઓને એક્સપાર્ટી કરવા અરજી રજુ કરતા આંક-૭ વાળી અરજી લગત અન્વયે રેકર્ડ પરની હકીકતોએ મારા પુરોગામી જજશ્રીએ પ્રતિવાદીઓ તરફે દાવો એકતરફી ચલાવવાનો હુકમ કરેલ.

(૦૩) આ કામના વાદી તરફે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ નીચે મુજબના રજુ થયેલ છે.

મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા	
આંક-૯	વાદી યોગરાજ બબુએ લાલનું પુરાવાનું સોગંદનામું
આંક-૧૧	પ્રતિવાદીએ વાદી બેંકને કરેલ અરજીપત્રકની ખરીનકલ તા.૬/૭/૨૦૨૩
આંક-૧૨	સેક્શન લેટરની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩
આંક-૧૩	એટેસ્ટેશન મેમો અને લેટર ઓફ એટેસ્ટેશનની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩
આંક-૧૪	હાઈપોથીકેશન ચાર્જ લેટરની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩
આંક-૧૫	લોન એગ્રીમેન્ટસની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩
આંક-૧૬	સીડયુલ-૩ની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩
આંક-૧૭	અપ્રાઈસલ નોટની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩
આંક-૧૮	ડીફોલ્ટેડ નોટીસની ખરીનકલ તા.૯/૧૦/૨૦૨૪
આંક-૧૯	ડીલીવરી ચલનની ખરીનકલ તા.૧૧/૭/૨૦૨૩
આંક-૨૦	અંડરટેકીંગ લેટરની ખરીનકલ
આંક-૨૧	સેક્શન ઓફ ક્રેડીટની ખરીનકલ
આંક-૨૨	સેક્શન વીઝીટની ખરીનકલ તા.૬/૭/૨૦૨૩
આંક-૨૩,૨૪	પી.એસ.આર. એકાઉન્ટની ખરીનકલ તા.૪/૭/૨૦૨૪

આંક-૨૫	બેંક સ્ટેટમેન્ટની ખરીનકલ
આંક-૨૬	વાદીના એડવોકેટ મારફતે પ્રતિવાદીને આપેલ લીગલ નોટીસની ખરીનકલ તા.૧૧/૧૦/૨૦૨૪
આંક-૨૭	કલોજીંગ પુરશીશ

આ કામે પ્રતિવાદીઓ તરફે કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો રજુ થયેલ નથી.

(૦૪) આ કામના વાદીની દાવાઅરજીના ન્યાયીક નિર્ણય અર્થે નીચે મુજબના આંક-૮/બી થી મુદ્દાઓનું નિર્માણ કરવામા આવેલ છે.

// મુદ્દાઓ //

- મુદ્દા નં.૧- શું વાદી બેન્ક પુરવાર કરે છે કે, પ્રતિવાદીઓએ વાદી બેંક પાસેથી લોન લઈ,વાદી બેંક જોગ જરૂરી તમામ દસ્તાવેજો / એગ્રીમેન્ટ કરી આપી તેમાં સહી કરી લોન લીધેલ છે ?
- મુદ્દા નં.૨- શું વાદી બેન્ક પુરવાર કરે છે કે, તેઓ પ્રતિવાદીઓ પાસેથી તેમની મિલકતમાંથી રૂ.૭,૯૦,૧૪૮/- વસુલ મેળવવા હકકદાર છે ?
- મુદ્દા નં.૩- શું વાદી બેન્કનો દાવો નિયત સમય-મર્યાદામાં કરવામા આવેલ છે ?
- મુદ્દા નં.૪- શું વાદી બેન્ક વ્યાજ મેળવવા હકકદાર છે ? જો હા તો કયા દરે ?
- મુદ્દા નં.૫- શું હુકમ અને હુકમનામું ?

(૦૫).. ઉપરોક્ત મુદ્દાઓ પરત્વેના મારા નિર્ણયો અને તે નિર્ણય પરત્વેના કારણો નીચે મુજબ છે.

// નિર્ણયો //

મુદ્દા નંબર-૧ ::- હકારમાં

મુદ્દા નંબર-૨ ::-હકારમાં

મુદ્દા નંબર-૩ ::- હકારમાં

મુદ્દા નંબર- ૪ ::- હકારમાં આખરી હુકમમાં જણાવ્યા મુજબ

મુદ્દા નંબર- ૫ ::- આખરી હુકમ મુજબ.

//કારણો//

મુદ્દા નંબર-૧ થી ૫ ની સંયુક્ત રીતે ચર્ચા

- (૦૬) આ કામે નિર્માણ કરવામાં આવેલ મુદ્દાઓ પૈકી મુદ્દા નંબર-૧ થી ૫ એક સાથે સંકળાયેલા હોય જેથી તે મુદ્દાઓની હકીકતોની ચર્ચાનું પુનરાવર્તન ટાળવા તે તમામ મુદ્દાઓની ચર્ચા એક સાથે કરેલ છે.
- (૦૭) આ કામે વાદી તરફે વિ.વકીલશ્રી વી.પી.શ્રીમાળીની રેકર્ડ મુજબની દલીલો ધ્યાને લીધી. પ્રતિવાદીઓ તરફે જાતે કે તેઓના વિ.વકીલશ્રી મારફતે હાજર ન હોય, પ્રતિવાદીઓ તરફે હાલનો દાવો એકતરફી ચાલેલ છે અને ગુણદોષ ઉપર હાલના દાવાનો ન્યાયનિર્ણય કરવામા આવે છે.
- (૦૮) વાદી બેંક દ્વારા હાલના દાવાના સમર્થનમાં બેંકના બ્રાંચ મેનેજરશ્રી યોગરાજ બબુલે લાલનાઓએ પુરાવાનું સોગંદનામું આંક-૯ થી રજુ રાખેલ છે જેમા તેઓએ દાવા અરજીની હકીકતોને સંપૂર્ણ સમર્થન આપેલ છે પરંતુ વાદી સાહેબની ઉલટતપાસ માટે આ કામે પ્રતિવાદીઓ હાજર રહેલ નથી. આ કામે વાદી તરફે આંક-૧૧ થી આંક-૨૬ સુધીના દસ્તાવેજી પુરાવાઓ રજુ થયેલ છે. આ કામે પ્રતિવાદીઓ તરફે વાદીની ઉલટતપાસના સ્વરૂપમાં વાદીના દાવાની હકીકતને પડકારવામા આવેલ નથી.
- (૦૯) આ કામે વાદીએ પ્રતિવાદીઓને આપેલ લોન સંદર્ભે પ્રતિવાદીઓએ આપેલ અરજીપત્રક આંક-૧૧ થી રજુ થયેલ છે અને આંક-૧૨ થી સેક્શન લેટરની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩,આંક-૧૩ થી એટેસ્ટેશન મેમો અને લેટર ઓફ એટેસ્ટેશનની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩,આંક-૧૪ થી હાઇપોથીકેશન ચાર્જ લેટરની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩,આંક-૧૫ થી લોન એગ્રીમેન્ટસની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩, આંક-૧૬થી સીડયુલ-૩ની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩,આંક-૧૭થી અપ્રાઇસલ નોટની ખરીનકલ તા.૭/૭/૨૦૨૩,આંક-૧૮ થી ડીફોલ્ટેડ નોટીસની ખરીનકલ તા.

૯/૧૦/૨૦૨૪,આંક-૧૯થી ડીલીવરી ચલનની ખરીનકલ તા.૧૧/૭/૨૦૨૩, આંક-૨૦ થી અંડરટેકીંગ લેટરની ખરીનકલ,આંક-૨૧ થી સેક્શન ઓફ ક્રેડીટની ખરીનકલ,આંક-૨૨ થી સેક્શન વીઝીટની ખરીનકલ તા.૬/૭/૨૦૨૩,આંક-૨૩ અને આંક-૨૪ થી પી.એસ.આર. એકાઉન્ટની ખરીનકલ તા.૪/૭/૨૦૨૪,આંક-૨૫ થી બેંક સ્ટેટમેન્ટની ખરીનકલ તથા આંક-૨૬ થી વાદીના એડવોકેટ મારફતે પ્રતિવાદીને આપેલ લીગલ નોટીસની ખરીનકલ તા.૧૧/૧૦/૨૦૨૪ રજુ કરવામા આવેલ છે. આ કામે વાદીના આંક-૯ ના મૌખિક પુરાવા મુજબ વાદીએ પ્રતિવાદીઓને આંક-૧૧ ની લોન મેળવવાની અરજી મુજબ કાર લોન મંજૂર કરેલી છે.આ કામના વાદીએ પ્રતિવાદીઓને આંક-૨૬ વાળી નોટીસ મોકલવા છતાં પ્રતિવાદીઓએ વાદી બેંકના લોનના નાણા ભરપાઈ કરેલા નથી તે હકીકત પુરવાર થાય છે. મુદ્દા નં.૧ પરત્વે વાદીએ આંક-૯ ના સોગંદનામામાં દસ્તાવેજી પુરાવા રીફર કરી આંક-૧૧ ની લોન મેળવવાની અરજી રજુ કરેલ છે જે મુજબ પુરવાર થાય છે કે પ્રતિવાદીઓએ વાદી બેંક પાસેથી લોન લેતા એગ્રીમેન્ટમાં તથા દસ્તાવેજોમાં સહી/ અંગુઠા કરી આપેલ છે. આ સંજોગોમાં મુદ્દા નં.૧ની હકીકત પુરવાર થાય છે. આ કામે વાદીએ પ્રતિવાદીઓ પાસેથી રૂ.૭,૯૦,૧૪૮/-મેળવવા માટે દાવો કરેલો છે જે સંદર્ભે વાદીએ આંક-૯ ના પુરાવાના સોગંદનામામાં જાહેર કરેલ છે કે,આ કામના વાદી બેંકની કાયદેસરની લેણી રકમ તા.૬/૧૦/૨૦૨૪ ના રોજે રૂ. ૭,૯૦,૧૪૭.૫૭/- (અંકે રૂપિયા સાત લાખ નેવું હજાર એકસો સુડતાલીસ અને સતાવન પૈસા પુરા) લેણી રકમ થાય છે.પ્રતિવાદીઓએ વાદીની ઉલટતપાસ કરી વિરુદ્ધની હકીકત સાબિત કરેલ નથી તે જ રીતે વિરુદ્ધની હકીકત સાબિત કરવા માટે પ્રતિવાદીઓએ કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો પણ રજુ કરેલ નથી.

આ કામે વાદીએ હાલનો દાવો તા.૨૯/૧/૨૦૨૫ ના રોજ દાખલ કરેલો છે. વાદીએ જાહેર કરેલ છે કે આ કામના વાદી બેંકની કાયદેસરની લેણી રકમ તા.૬/૧૦/૨૦૨૪ ના રોજે રૂ.૭,૯૦,૧૪૭.૫૭/- (અંકે રૂપિયા સાત લાખ નેવું હજાર એકસો સુડતાલીસ અને સતાવન પૈસા પુરા) ની

રકમ વસુલવાપાત્ર થાય છે. આ સંદર્ભે વાદીએ આંક-૧૧ થી આંક-૨૬ અન્વયેના દસ્તાવેજી પુરાવા રજુ કરેલા છે. વાદીએ આંક-૨૬ ની નોટીસ આપવા છતાં પ્રતિવાદીઓએ વાદી બેંકના નાણા ભરપાઈ ન કરતા હાલનો દાવો દાખલ કરેલ છે અને વાદીની દાવાની હકીકત અને મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા ધ્યાને લેતા સમયમર્યાદામાં વાદીએ હાલનો દાવો દાખલ કરેલ છે તેથી વાદી દાવા અરજીમાં અને સરતપાસમાં જણાવેલ બેંકની લેણી રકમ મેળવવા હકકદાર થતા હોવાનું જણાઈ આવે છે જેથી મુદ્દા નં.૧ થી ૪ નો જવાબ હકારમાં ઠરાવવામા આવે છે. આ કામે વાદીના વિ.વકીલશ્રીની રજુઆત છે કે, વાદી બેંક જાહેર સાહસ છે તે સંસ્થા લોકોના નાણાથી જાહેરહિતમાં ચલાવવામા આવે છે. પ્રતિવાદીઓએ કારની લોન લીધેલી છે. જે લોનના નાણા ચડત વ્યાજ સહિત પ્રતિવાદીઓ ચુકવી આપવા બંધાયેલા છે. જેથી પ્રતિવાદીઓએ નાણા ચુકવવામા ગંભીર બેદરકારી અને ચુક રાખેલી હોય, ૧૨% વ્યાજ સહિત ચડત નાણા ચુકવી આપવા માટે નામ.કોર્ટે આદેશ કરવો જોઈએ. આ કામે વાદીએ દાવા અરજીમાં તેમજ સોગંદનામામાં કેટલા ટકા વ્યાજના દરે આ કામના પ્રતિવાદીઓને કારની લોન આપેલી તે હકીકત જાહેર કરેલી નથી, પરંતુ વાદીએ આંક-૧૨ ના લેટર ઓફ સેક્શન રજુ કરેલ છે જેમાં પ્રથમ વર્ષ માટે ૯% ના વ્યાજના દરથી અને ત્યારબાદ ૮.૬૫ % વ્યાજના દરથી પ્રતિવાદીઓને લોન આપેલાનું દર્શાવેલ છે. સદર વ્યાજના દરે પ્રતિવાદી એ વાદી બેંકને નાણા પરત ચુકવવાના થાય છે તેથી પ્રતિવાદીએ કરારથી નકકી કર્યા મુજબની લેણી રકમ રૂ.૭,૯૦,૧૪૮/-પર ૯ (નવ) % વ્યાજની રકમ સાથે પ્રતિવાદીઓ સંયુક્ત રીતે ચુકવવા જવાબદાર થતા હોવાનું ઠરાવવામા આવે છે તે રીતે મુદ્દા નં.૫ પરત્વે નીચે મુજબનો આખરી હુકમ ફરમાવવામાં આવે છે.

//આખરી હુકમ//

(૦૧).વાદીનો દાવો આથી અંશતઃ મંજૂર કરવામા આવે છે.

(૦૨). આ કામના વાદીએ પ્રતિવાદીઓ પાસેથી બાકી લેણી રકમ રૂ.૭,૯૦,૧૪૮/-પર

૯(નવ) % વ્યાજની રકમ સાથે દાવો દાખલ કર્યા તારીખથી લોનની રકમ વસુલ આવે તે તારીખ સુધી પ્રતિવાદીઓની જાત તથા તારણમાં મુકેલ તેમજ અન્ય હરેક પ્રકારની માલ મિલકતમાંથી વસુલ મેળવવા હકકદાર હોવાનું ઠરાવવામા આવે છે.

(૦૩). વાદીને દાવાનો ખર્ચ પ્રતિવાદીઓએ ચુકવી આપવો.

(૦૪).હુકમ મુજબ હુકમનામું દોરવું.

હુકમ આજ તા.૧૦મી, માહે-સપ્ટેમ્બર, સને-૨૦૨૫ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી સહી કરી જાહેર કરવામાં આવ્યો.

તારીખ:૧૦-૦૯-૨૦૨૫
ભચાઉ-કચ્છ

સહી/-
(વિશાલકુમાર યોગેશકુમાર ત્રિવેદી)
GJ-01287
પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ
ભચાઉ-કચ્છ.